

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા તા.૦૯/૦૧/૨૦૧૮ ના રોજ આયોજીત
પ્રથમ પ્રવાસી ભારતીય સાંસદોના સેમીનારમાં ગૃહ અને એન.આર.જી. મંત્રીશ્રી
પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત સરકાર વતી હાજરી આપી



(પ્રવાસી ભારતીય સાંસદોને સંબોધતા માન. પ્રધાનમંત્રીશ્રી અને પ્રથમ હરોળમાં ઉપસ્થિત માન. રા.ક.મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા)

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે ૭ થી ૯ જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત વર્ષ ૨૦૦૩ થી કે જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીજી જ્યારે દેશના પ્રધાનમંત્રી હતા ત્યારથી કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત વિદેશમાં હાલ વર્તમાન જે પ્રવાસી ભારતીય સાંસદો અને મેયરો હોય તેમને આમંત્રિત કરીને તા.૦૯/૦૧/૨૦૧૮ ના રોજ નવી દિલ્હી ખાતે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમ યોજવા માટે માન. પ્રધાનમંત્રીશ્રી વિદેશ મંત્રાલયને સૂચન કરેલ જેના ફળ રૂપે ૨૪ દેશોમાંથી ૧૨૪ પ્રવાસી ભારતીય સાંસદો (PIO – Parliamentarian) અને ૧૭ મેયર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને માન. ઉપરાષ્ટ્રપતિશ્રી દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

૨. આ કાર્યક્રમમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી દરેક રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી / એન.આર.આઈ.ની બાબત સંભાળતા માન. મંત્રીશ્રીને નિમંત્રણ પાઠવેલ હતું.

સમગ્ર દેશના ૩૨ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર તરફથી માન. રા.ક.મંત્રીશ્રી (ગૃહ અને એન.આર.જી.) શ્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

૩. કાર્યક્રમને સંબોધતા માન. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દુનિયામાં ભારતના જો કોઈ સ્થાયી એમ્બેસેડર હોય તો તેઓ એટલે કે પ્રવાસી સાંસદો છે. દુનિયામાં જે ભાગમાં પણ ગયા ત્યાં દેશની ઓળખ બનાવી છે અને દેશનું ગૌરવ વધાર્યું છે. હાજર રહેલ તમામને તેમણે મીની વર્લ્ડ પાર્લામેન્ટ ગણાવી હતી. ભારતથી ગયેલા લોકોનું મન અને આત્માના અંશ ભારતની જમીન પર છોડીને આપ સર્વે ત્યા સ્થાયી થયા છો. પોતાના વક્તવ્યમાં માન. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં દુનિયાનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાયો છે અને લોકો ભારતની નોંધ લેવા લાગ્યા છે. ભારત સામાજિક, આર્થિક અને વૈચારિક રીતે બદલાઈ રહ્યું છે. ભારતમાં દરેક સ્તરે બદલાવ આવી રહ્યો છે. વર્લ્ડ બેન્ક, IMF અને મૂડિઝ જેવી સંસ્થાઓ ભારત તરફ આશાની મીટ માંડે છે. ભારતમાં રેલવે, હાઈવે, પોર્ટ વે અને આઈ વે બમણી ગતિથી આગળ વધી રહ્યું છે. ભારતમાં FDI રોકાણમાં મોટો વધારો થયો છે. નેપાળ, શ્રીલંકા, યમન કે અન્ય દેશોમાં સંકટ સમયે ભારતે લોકોને મદદ કરી છે. પ્રવાસી ભારતીયોને ભારત સરકાર પાર્ટનર માને છે અને ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. વર્ષ ૨૦૧૯ પ્રયાગ – અલ્હાબાદમાં કુંભ મેળાનું આયોજન છે. તેનો લાભ લેવા સર્વેને આમંત્રણ પાઠવ્યું હતું.

૪. કાર્યક્રમ અંતર્ગત પ્રવાસી ભારતીય સાંસદોએ ‘સંઘર્ષ થી સંસદ સુધીની મુસાફરી’ અને ‘ભારતનું પુનરોત્થાન – પ્રવાસી સાંસદોનો ફાળો’ એમ બે સેશનમાં ભાગ લીધો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત પ્રવાસી સાંસદો આ કાર્યક્રમના આયોજનથી પ્રભાવીત થયા હતા.